

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
(ગુજરાત એક્ટ નં.૨૪/૨૦૧૫ દ્વારા સ્થાપિત)
Shri Govind Guru University
(Established vide Gujarat Act No. 24/2015)

સરકારી પોલિટેકનીક કેમ્પસ
ગદકપુર, ગોધરા
જિલ્લો પંચમહાલ પિન કોડ ૩૮૯૦૦૧
નં.એસજીજીયુ/યોગ/૨૦૧૬/

Government Polytechnic Campus
Gadukpur, Godhra
Dist. Panchmahals Pin Code 389001
તા. ૧૪/૦૬/૨૦૧૬

પરિપત્ર-૨૮

સંદર્ભ: ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીના પત્ર ક્રમાંક/CHE/KCG/યોગ/૨૦૧૬/૫૮૨

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની દેન એવી યોગ વિદ્યા વૈશ્વિક સ્તર પર સ્વીકૃતિ પામેલ છે. તદ અનુસાર પ્રતિ વર્ષે ૨૧મી જુનને “વિશ્વ યોગ દિન” તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જાહેર કરતા ગુજરાત રાજ્યમાં તેમજ સમગ્ર ભારત તેમજ વિશ્વમાં તા. ૨૧મી જુને “આંતર રાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવણી થાય છે.

રાજ્ય સરકારશ્રીના આદેશ અનુસાર યુનિવર્સિટીએ કોલેજ કક્ષાએ ૨૧મી જુને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવાના નિર્ણય કરેલ છે. તદ અનુસાર નીચેની સૂચનાનો અમલ કરવા જણાવવામાં આવેલ છે.

૧. ૨૧ મી જુન વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી માટે કોલેજ કક્ષાએ યોગ દિવસના ઇન્યાર્જ ની નિમણુક કરવી જરૂર જણાય તો સહઇન્યાર્જની પણ નિમણુક કરવી.

૨. યોગ ઇન્યાર્જની તાલીમ માટે ટ્રેનર્સની ફાળવણી જે તે જિલ્લા કલેક્ટરશ્રીની કચેરી માંથી થવાની છે તો જરૂર જણાય તો ટ્રેનર્સની સંખ્યાની વિગત યુનિવર્સિટી કે સ્થાનિક કલેક્ટરશ્રીની કચેરીમાં જાણ કર્યે ટ્રેનર્સની ફાળવણી કરવામાં આવશે.

૩. યોગ દિવસના કાર્યક્રમનું નિર્દેશન માટેનું સાહિત્ય તથા CD યુનિવર્સિટી દ્વારા પૂરું પાડવામાં આવશે. યોગનું નિર્દેશન બાયસેગ દ્વારા પણ ઉપલબ્ધ કરી શકાશે.

૪. કોલેજ કક્ષાના કાર્યક્રમનું સ્થળ નિશ્ચિત કરી યુનિવર્સિટીને જાણ કરવી. સ્થાનિક કોલેજો એક સ્થળે એકત્રિત કરી કાર્યક્રમ કરી શકશે. એક કરતા વધુ કોલેજોના સામુહિક કાર્યક્રમ વિચારેલ હોયતો તેના સ્થળની યુનિવર્સિટીને જાણ કરવી.

૫. કોલેજોના યોગ દિવસમાં ભાગ લેનાર વિદ્યાર્થીની સંખ્યા નિશ્ચિત કરવી. વધુમાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવા પ્રયત્ન કરવો.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી
(ગુજરાત એક્ટ નં. ૨૪/૨૦૧૫ દ્વારા સ્થાપિત)
Shri Govind Guru University
(Established vide Gujarat Act No. 24/2015)

સરકારી પોલિટેકનીક કેમ્પસ
ગદકપુર, ગોધરા
જિલ્લો પંચમહાલ પિન કોડ ૩૮૯૦૦૧

Government Polytechnic Campus
Gadukpur, Godhra
Dist. Panchmahals Pin Code 389001

૬. ૨૧ જુન પહેલા યોગના મહત્વ વિષે કોલેજોમાં વ્યાખ્યાનો રાખવા.
૭. કોલેજ કક્ષાના NCC/NSS ના સ્વયંસેવકોને જવાબદારી સોંપવી.
૮. સ્થાનિક NGO નો સહયોગ પ્રાપ્ત કરવો. (જેવા કે, રોટરી, લાયન્સ, જેસીસ વગેરે)
૯. ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીના સંદર્ભમાં દર્શાવેલ પરિપત્ર ની સુચનાનુ યુસ્તપણે પાલન કરવું અને માંગ્યા પ્રમાણેની માહિતી અચૂક મોકલવી.

આપનો વિશ્વાસુ

કુલસચિવ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી,
ગોધરા.

બિડાણ : ઉપર મુજબ

પ્રતિ.

- આ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ તરફ.

નકલ રવાના:

૧. ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રી, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
૨. કલેક્ટરશ્રી, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, પંચમહાલ, ગોધરા.
૩. કલેક્ટરશ્રી, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, મહીસાગર.
૪. કલેક્ટરશ્રી, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, દાહોદ.
૫. કલેક્ટરશ્રી, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, છોટા ઉદેપુર.
૬. કલેક્ટરશ્રી, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, વડોદરા.